



NSL/CS/2025/44

Date: December 19, 2025

To,  
The Department of Corporate Services  
**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers  
Dalal Street,  
Mumbai - 400 001

**Scrip Code: 542231**

To,  
The Listing Department  
**National Stock Exchange of India Limited**  
Exchange Plaza, C/1, Block G,  
Bandra-Kurla Complex, Bandra (E),  
Mumbai - 400 051

**Scrip Symbol: NILASPACEs**

Dear Sir/ Madam,

**Sub: Newspaper Notice to the Shareholder for Opening Special Window to Lodge Physical Share Transfer**

**Ref: SEBI circular No. SEBI/HO/MTRRD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 02 July 2025**

Please find enclosed copies of the newspaper publication titled "Notice to the Shareholders" with respect to Special Window for re-lodgment of transfer requests of physical shares, published in today's Loksatta Jansatta and Business Standard. The same are also available on the Company's website at [www.nilaspaces.com](http://www.nilaspaces.com).

Thanking you,  
Yours faithfully,  
**For, Nila Spaces Limited**

**Ms. Gopi Dave**  
**Company Secretary**

Encl: a/a

## NOTICE

**LLOYDS METALS AND ENERGY LIMITED Fv1**

Registered Office : Plot No. A-9 &amp; 10,

Phase II, M.I.D.C. Dombivli (E), Dist. Thane- 421201

NOTICE is hereby given that the certificate(s) for the undermentioned securities of the Company has / have been lost / misplaced and the holder(s) of the said securities / applicant(s) has / have applied to the Company to issue duplicate certificate(s)

Any person who has a claim in respect of the said securities should lodge such claim with the Company at its Registered Office within 15 days from this date, else the Company will proceed to issue duplicate certificate(s) without further intimation.

Name of Share Holders	Folio No.	Certi. No.	Distinctive From - To	No. of Shares
Motiwani Fatehchad Lt. Motwani Sushila	0348368	1302	1479641 to 1480640	1000

Place : Ahmedabad  
Date : 18-12-2025

Name of Applicant  
Fatehchand Bhagwandas Motwani



Regional Office Jamnagar : First Floor,  
M P House, Saru Section Road, Jamnagar.  
Ph. 0288- 2675172 / 2660779 / 2677372

**NOTICE : SHIFTING OF LOCKERS OF OUR MOTI KHAVDI BRANCH, DIST. JAMNAGAR**

In our endeavour to strengthen our services to our locker holder customers, Safe Deposit Locker Cabinets of our **Moti Khadi Branch**, presently situated at Strong Room at Basement of Branch Premises will be Shifted to newly constructed Strong Room at Ground Floor of Same Premises on **01.01.2026**. We also wish to inform all the locker holder customers of our **Moti Khadi Branch** that utmost care will be taken while shifting the lockers to the proposed location. However, if any of our customers is desirous of taking possession of his/her contents/belongings before shifting and redeposit the same after shifting of the lockers to the proposed location, we request you to do so on or before **31.12.2025** during office hours by visiting our **Khavdi Branch**. With effective from **01.01.2026**, lockers can be operated from proposed new location.

We sincerely regret the inconvenience caused to you in this regard and assuring you of our best services at all times.

Regional Head

## Public Notice

It is hereby notified to the public that in Village Sankal (Tanakhala) Ta. Naswadi G. Chotaudepur At. Dwarkadhish Mandir, Naswadi-Tankhla Road East, in the area of 0-81-00 (8100 sq. m.) in Revenue Survey No. 24, in the area of 0-81-00 (8100 sq. m.) in non-cultivated land, out of the residential plots numbered 73 whole and 72 half of the vacant land dated, 27/01/2015, the document The original document taken from the sale from number 61 has been lost and cannot be found. Therefore, we request you to obtain a true copy of the document from the Sub-Registrar's office and request for title clearance from us so that any individual, bank society, or any other institution or anyone has any interest or burden in this property, please send a written objection to us by speed post on the 7th day of the publication of this notice, along with the proof. If there is no objection in the matter, then further appropriate action will be taken regarding title clearance. The public should take a clear note of this.

By the notice and order of the client (Advocate and Notary)  
Shajidbhai Y Memon  
Address : Kavant road near H.D.F.C bank at & ta. Naswadi Dist.Chotaudepur, Gujarat.  
Mo. 94284 30786

Dated 15/12/2025

Place: Naswadi

**(See Rule 8(1)) Possession Notice (For Immovable Property)**

Whereas The undersigned being the Authorised Officer of the **Bank of India, Kalawad Road Branch** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with (rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated **29.09.2025** calling upon the Borrower **Mrs. Minaben Shakarbai Mandviya (Borrower)**, **Mr. Rajeshbhai Shakarbai Mandviya (Co-Borrower)** and **Mr. Hitesh Shakarbai Mandviya (Co-Borrower)** and **Mr. Rameshbhai Hirabhai Narola (Guarantor)**, At Plot No. 221, Block No. 1, Avadh Park, Street No. 4, Opp. Bharat Petroleum, Off. Rail Nagar Main Road, Rajkot, Gujarat- 360001

**Borrowers Mrs. Minaben Shakarbai Mandviya, Mr. Rajeshbhai Shakarbai Mandviya (Co-Borrower) and Mr. Hitesh Shakarbai Mandviya (Co-Borrower) and Guarantor Mr. Rameshbhai Hirabhai Narola** to repay the amount mentioned in the Demand Notice being **Rs. 25,01,960.11 (Rupees Twenty Five Lakhs One Thousands Nine Hundred Sixty Rupees and Paisa Eleven)** as on 29.09.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantors and the Public in general that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **December 12, 2025**.

The Borrower / Guarantors in particular and the Public in general is hereby cautioned not to dealing with the property will be subject to the charge of the **Bank of India, Kalawad Road Branch**, Shop No. 1 & 2, Rivera Wave Complex, Ground Floor, Nr. RPJ Hotel, Jaddu's Chowk, Rajkot, Gujarat for an amount of **Rs. 25,01,960.11 (Rupees Twenty Five Lakhs One Thousands Nine Hundred Sixty Rupees and Paisa Eleven)** as on 29.09.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**

**All the Pieces and Parcels of Land with Buildings, Sheds & Structures, Fixtures and Fittings erected or installed thereon (both present and future),** at Plot No. 221, Block No. 1, Avadh Park, Street No. 2, Opp. Bharat Petroleum, Off Rail Nagar Main Road, Rajkot, Gujarat - 360001 in the Name of **Mrs. Minaben Shakarbai Mandviya. Bounded by : North : Measurement 15.25 Mtr. adjoining Sub-Plot No. 2189 to 2212, South : Measurement 15.25 Mtr. adjoining Plot No. 222, East : Measurement 3.35 Mtr. adjoining 7.50 Mtr. Wide Road, West : Measurement 3.35 Mtr. adjoining Plot No. 228**

**Date : 12.12.2025, Chief Manager & Authorised Officer Bank of India, Kalawad Road Branch Place : Rajkot**

**(See Rule 8(1)) Possession Notice (For Immovable Property)**

Whereas The undersigned being the Authorised Officer of the **Bank of India, Kalawad Road Branch** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with (rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated **25.08.2025** calling upon the Borrower **Mrs. Bhartiaben Hiteshbhai Rathod (Borrower - Mortgagor)** and **Mr. Hiteshbhai Balabhai Rathod (Co-Borrower - Mortgagor)**, At Plot No. 30, Ayodhya Park, Near Sukhsagar Hall, Bhagwatipara, Rajkot, Gujarat- 360 003.

**Borrowers Mrs. Bhartiaben Hiteshbhai Rathod and Co-Borrower Mr. Hiteshbhai Balabhai Rathod** to repay the amount mentioned in the Demand Notice being **Rs. 12,36,161.27 (Rupees Twelve Lakhs Thirty Six Thousand One Hundred Sixty One and Paisa Twenty Seven)** as on 25.08.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantors and the Public in general that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **December 12, 2025**.

The Borrower / Guarantors in particular and the Public in general is hereby cautioned not to dealing with the property will be subject to the charge of the **Bank of India, Kalawad Road Branch**, Shop No. 1 & 2, Rivera Wave Complex, Ground Floor, Nr. RPJ Hotel, Jaddu's Chowk, Rajkot, Gujarat for an amount of **Rs. 12,36,161.27 (Rupees Twelve Lakhs Thirty Six Thousand One Hundred Sixty One and Paisa Twenty Seven)** as on 25.08.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**

**All the Pieces and Parcels of Land with Buildings, Sheds & Structures, Fixtures and Fittings erected or installed thereon (both present and future),** situated at R. S. No. 10 paiki 4, Plot No. 30, Ayodhya Park, Near Sukhsagar Hall, Bhagwatipara, Rajkot, Gujarat - 360 003, Admeasuring 51.06 Sq. Mtrs. in the Name of **Mrs. Bhartiaben Hiteshbhai Rathod. Bounded by : North : Property of Plot No. 31, South : Property of Plot No. 29, East : 7.50 Mtr. Road, West : Property of Plot No. 5**

**Date : 12.12.2025, Chief Manager & Authorised Officer Bank of India, Kalawad Road Branch Place : Rajkot**

**(See Rule 8(1)) Possession Notice (For Immovable Property)**

Whereas The undersigned being the Authorised Officer of the **Bank of India, Kalawad Road Branch** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with (rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated **30.09.2025** calling upon the Borrower **Mrs. Kamlaben Rameshbhai Solanki (Borrower - Mortgagor)** and **Mr. Rameshbhai Mansukhbhai Solanki (Co-Borrower)**, At Plot No. 218 to 221/2, Avadh Park, Street No. 2, Near Subhash Chandra Bose Township, Off. Rail Nagar Fire Station, Off Rail Nagar Main Road, Rajkot, Gujarat- 360001

**Borrowers Mrs. Kamlaben Rameshbhai Solanki and Co-Borrower Mrs. Rameshbhai Mansukhbhai Solanki** to repay the amount mentioned in the Demand Notice being **Rs. 21,31,363.82 (Rupees Twenty One Lakhs Thirty One Thousands Three Hundred and Sixty Three Rupees and Paisa Eight Two)** as on 30.09.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantors and the Public in general that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **December 12, 2025**.

The Borrower / Guarantors in particular and the Public in general is hereby cautioned not to dealing with the property will be subject to the charge of the **Bank of India, Kalawad Road Branch**, Shop No. 1 & 2, Rivera Wave Complex, Ground Floor, Nr. RPJ Hotel, Jaddu's Chowk, Rajkot, Gujarat for an amount of **Rs. 21,31,363.82 (Rupees Twenty One Lakhs Thirty One Thousands Three Hundred and Sixty Three Rupees and Paisa Eight Two)** as on 30.09.2025 with further interest, cost, expenses and other incidental charges etc. thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**

**All the Pieces and Parcels of Land with Buildings, Sheds & Structures, Fixtures and Fittings erected or installed thereon (both present and future),** at R. S. No. 601 paiki, Plot No. 220 (Sub Plot No. 218 to 221/ 2), Avadh Park, Street No. 2, Near Subhash Chandra Bose Township, Off. Rail Nagar Fire Station, Off Rail Nagar Main Road, Rajkot, Gujarat- 360001. Admeasuring 51.08 Sq. Mtrs. in the Name of **Mrs. Kamlaben Rameshbhai Solanki. Bounded by : North : Plot No. 219 (Sub-Plot No. 218 to 221/3) adjoining Measurement 15.25 Mtr. South : Plot No. 221 (Sub-Plot No. 218 to 221/1) adjoining Measurement 15.25 Mtr. East : Measurement 3.35 Mtr. adjoining 7.50 Mtr. Wide Road, West : Measurement 3.35 Mtr. adjoining Plot No. 229**

**Date : 12.12.2025, Chief Manager & Authorised Officer Bank of India, Kalawad Road Branch Place : Rajkot**

**CORRIGENDUM**

Re: Publication dated 03/12/2025 with regards to Public Notice for Sale by E Auction in the account of **Mrs. Aum Cotton Co.**

This official corrigendum is issued to rectify an inadvertent error in the Public Notice for Sale by E-Auction regarding the assets of **Mrs. Aum Cotton Co., originally published in Business Standard and Jai hind on December 03, 2025.**

The previous notice incorrectly stated the last date of bid submission. The revised date for the bid submission is as follows:

Detail	Previously Stated	Corrected Dated
Last date for submission of Bid:	21-12-2025 till 4.00 PM	22-12-2025 till 4.00 PM

Please note that all other terms, conditions, and details provided in the original public notice remain unchanged and in full effect. This clarification is issued for the information of all prospective bidders and stakeholders.

Sd/- AUTHORISED OFFICER  
Pegasus Assets Reconstruction Private Limited  
(Trustee of Pegasus 2024 Trust 1)  
Place: Rajkot & Atkot, Gujarat  
Date: 19/12/2025

## PUBLIC NOTICE

It is hereby notified that Locker No. BB223 (Key No. BB0620253) at Punjab National Bank, Sayajiganj Branch, Vadodra, is not issued to any customer as per bank records and the locker key is not traceable.

The bank proposes to break open the locker and install a new lock as per bank rules. Any person having objection/claim may contact the undersigned **within 7 days** from the date of publication of this notice. Failing which, the bank will proceed further without any notice.

**Contact: Rahul Sen, Sr. Branch Manager  
PNB Sayajiganj Branch, Vadodara  
Mob: 7412842232 | Email: bo062010@pnb.bank.in**

## PUBLIC NOTICE

We hereby informing to general public at large that the immovable property tenement no. 11, having plot area admeasuring 138.80 Sq. meter, along with construction that is 76.82 Sq. meter, in Anandbag Cooperative Housing Society Limited, the scheme famously known as "Anandbag Society", constructed on land bearing New Survey no. 4685 (Amalgamation Old survey no. 1649/1+3), T. P. scheme no. 1, final plot no. 10, situate, being and laying at Mouje Bava, Taluka Bava, in the registration district Ahmedabad and sub-district Bava is presently in the possession and occupation of Mr. Bhaveshkumar Dahyabhai Patel.

The said property was originally allotted by Anandbag Co-operative Housing Society Ltd. to Smt. Indumatiniben Dahya bhai Shah by way of a share certificate dated 15.09.1980. Thereafter, upon the demise of Smt. Indumatiniben Dahyabhai Shah on dt. 28.05.1995, the said property devolved upon Bharathathi Dahyabhai, Ajaybhai Dahyabhai, Harshaben Dahyabhai, Akaben Dahyabhai, Dharmendra Dahyabhai, and Atulkumar Dahyabhai. Subsequently, Bharat bhai Dahyabhai, Ajaybhai Dahyabhai, Harshaben Dahyabhai, Akaben Dahyabhai, and Dharmendra Dahyabhai relinquished their respective rights and shares in the said property in favor of Atulkumar Dahyabhai Shah by executing consent letters. Accordingly, the share certificate of the said property was transferred in the name of Atulkumar Dahyabhai Shah. Thereafter, Atulkumar Dahyabhai Shah sold the said property to Bhaveshkumar Dahyabhai Patel, for which a registered sale deed No. 9 was executed on 02.01.2023. Since then, the said property has been in the possession and enjoyment of Bhaveshkumar Dahyabhai Patel.

If any bank, financial institution, government or semi-government body, private company, individual, or any other heir has any claim, right, title, interest, or objection whatsoever in respect of the said property, they are hereby called upon to submit their objections along with documentary evidence within 7 days from the date of publication of this notice at the address mentioned below. If no objection is received within the stipulated period, it shall be presumed that the title of the said property is clear, and thereafter a No Objection Certificate shall be issued. No claims or objections raised after the expiry of 7 days shall be entertained.

**LE EXPART ASSOCIATES - M. H. Bloch (Advocates)**

Place : Ahmedabad  
Date : 19.12.2025

G-812, Titanium City Center, Prahladnagar Main Road,  
Opp. Seema Hall, Ahmedabad. Mo. No. 9904022116

**NOTICE TO THE SHAREHOLDERS**

SEBI has permitted opening of a special window to facilitate re-lodgement of transfer requests of physical shares lodged prior to the deadline of 01 April 2019 and rejected / returned due to deficiency in the documents. The shareholders are requested to refer SEBI Circular No. SEBI/HO/MIRDP/MRSD-PoD/PI/CIR/2025/97 dated 02 July 2025, for detailed information. As per the said circular only those shareholders whose transfer deeds were rejected / returned due to deficiency in documents, are permitted to re-lodge their transfer requests. The re-lodgement can be made only upto 06 January 2026 by submitting original transfer documents, along with corrected or missing details to the RTA of the Company MCS Share Transfer Agent Limited at its office address 201, 2nd Floor, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad – 380009. Helpline Number +91 79-26580461/62; Email: mcstahmtd@gmail.com; secretarial@nilaspaces.com. The shares that are re-lodged for transfer shall be issued only in the demate mode. For any clarification or guidance, the shareholders can contact the above referred contact details.

Date: 18-12-2025  
Place: Ahmedabad

For NILA SPACES LIMITED  
Gopi Dave  
Company Secretary

**NIDO HOME FINANCE LIMITED**

(formerly known as Edelweiss Housing Finance Limited)

Registered Office Situated At Tower 3, 5th Floor, Wing 'B', Kohinoor City Mall , Kohinoor City, Kiro Road, Kuria (West), Mumbai – 400 070. Regional Office at: Office No. 301,302,303,304, 3rd Floor, 3rd Eye Vision Building, IIM - Panjrapole Road, Ahmedabad – 380015

**POSSESSION NOTICE UNDER RULE 8(1) OF THE SARFAESI ACT, 2002**

Whereas The undersigned being the Authorized Officer of **Nido Home Finance Limited** (formerly known as Edelweiss Housing Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices to the Borrower/s detailed hereunder, calling upon the respective Borrowers to repay the amount mentioned in the said notices with all costs, charges and expenses till actual date of payment within 60 days from the receipt of the same. The said Borrowers/Co borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Co borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described hereunder in exercise of powers conferred on him under Section 13(4) of the said Act r/w Rule 8 of the said Rules in the dates mentioned along with the Borrowers in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of **Nido Home Finance Limited** (formerly known as Edelweiss Housing Finance Limited). For the amount specified therein with future interest, costs and charges from the respective dates.

Details of the Borrowers, Co-borrowers and Guarantors, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed thereunder and Date of Possession is given as under:

1. Name and Address of the Borrower, Co Borrower, Guarantor Loan Account No. And Loan Amount:-  
**MANISH DHIRAJAL SAVALIYA (BORROWER) GITABEN DHIRUBHAI SAVALIYA (CO-BORROWER)** Resi Address: Flat No 402, 4, Th Flavira, Residency Underneath, Laxmi Narayan, Sc, B-Hrjyanka, Park Surat 394327  
Lan.No.: L03005THL000005334680 Loan Agreement Date: 30/06/2024

Loan Amount: Rs. 5,25,000/- (Rupees Five Lakh Twenty Five Thousand Only) Demand Notice Date: 18-09-2025  
Amount Due In Rs. 5,49,977.91/- (Rupees Five Lakhs Forty Nine Thousand Nine Hundred Seventy Seven and Ninety One Paisa Only)

Constructive / Symbolic Possession Date: 13.12.2025

SCHEDULE OF THE PROPERTY:- All That Piece And Parcel Of The Property Bearing Flat No. 402 On The 4th Floor Admeasuring 588 Sq. Feet Super Built Up Area & 294 Sq. Feet I.E. 27.32 Sq. Mtrs. Built Up Area, Along With Undivided Share In The Land Of "Avira Residency Of Shree Laxminarayana Society", Situate At Block No. 116 Paiki Plot No. 103 & 104 Admeasuring 155.54 Sq. Yard I.E. 13.06 Sq. Mts. Of Moje Village Kadodra, Ta: Palsana, Dist: Surat & Bounded As Under:- North: Margin & Road South: Entry & Passage East: Flat No. 402 West: Margin

2. Name and Address of the Borrower, Co Borrower, Guarantor Loan Account No. And Loan Amount:-  
**SATARBHAI HUSHENBHAI MALEK (BORROWER) JARINA SATARBHAI MALEK (CO-BORROWER)** Resi Address: Plot no 63/P, Middlepatargarahema, Tnmajishehainanoli, Veravalakota, Road Veraval 362265  
LAN.No.: L20305THL000005334730 Loan Agreement Date: 10/07/2024

Loan Amount: Rs. 9,27,000/- (Rupees Nine Lakhs Twenty Seven Thousand Only) Demand Notice Date: 27-09-2025  
Amount Due In Rs. 9,53,884.44/- (Rupees Nine Lakhs Fifty Three Thousand Eight Hundred Eighty Four and Forty Four Paisa Only)

Constructive / Symbolic Possession date: 15.12.2025

SCHEDULE OF THE PROPERTY:- All That Right, Title And Interest Of Property Bearing A Residential House Constructed On Land Admeasuring 397 Sq. Mtrs. 48-80 Of Plot No. 63 Paiki (Northernly Side Of Southern Side Plot) Of N. R. S. No. 430/1/ Paiki 2 & R. S. No. 430/2/ Situated Within Limits Of Veraval Municipality. North: Adj. Land Of Plot No. 63 Paiki, South: Adj. Land Of Plot No. 63 Paiki. East: Adj. Land Of Plot No. 63 Paiki. West: Adj. 7-50 Mtrs. Wide Road.

Sd/- Authorized Officer  
FOR Nido Home Finance Limited,  
(formerly known as Edelweiss Housing Finance Limited)

## SBI STATE BANK OF INDIA

**Home Loan Centre Mehsana****POSSESSION NOTICE [RULE - 8 (1)] (For immovable property)**

Whereas; The undersigned being the Authorised Officer of the **State Bank of India, Home Loan Centre Mehsana 384002** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated **29.09.2025** calling upon the borrower **Smt. Kaminiaben Ketankumar Suthar & Ketankumar Kashiram Suthar** to repay the amount mentioned in the notice being **Rs. 4122896.71 (Rupees Forty One Lakh twenty two Thousand eight hundred ninety six and paisa seventy one Only)** as on 29.09.2025 plus further interest at the contractual rate and incidental expenses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known – unknown), legal representatives (known – unknown), and the public in general that the undersigned has taken **Symbolic** of the property described herein below in exercise of powers conferred by him under Section 13 (4) of the said [Act] read with Rule 8 of the said rules on this **29 day of Month September of the year 2025**.

The borrower, legal heirs (known – unknown), legal representatives (known – unknown), and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **State Bank of India** for an amount of **Rs.4122896.71 (Rupees Forty one Lakh Twenty two Thousand eight hundred ninety six and paisa seventy one only)** as on 29.09.2025 with further interest and incidental expenses, costs, charges etc. thereon.

The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of Mortgaged property**

All those pieces and parcels of the immovable property Situated at R.S.No 889 (Old R.S.94) Plot no 34 as per site plot no 76 SAMVED villa Sini Nagapur Taluka and district Mehsana. East: Internal Road, West: Water drain Canal, North: Old R.S.No 95, South: Plot no 35 As per site plot no 75

**Date: 18.12.2025**  
**Place: Mehsana**

Authorized Officer  
**STATE BANK OF INDIA, HLC Mehsana**

**APPENDIX – IV (Rule-8(1))****POSSESSION NOTICE (for immovable property)**

Where as, The undersigned being the Authorized Officer of the **Indian Bank** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **28.04.2025 and published on 02.05.2025** Calling upon the Borrower/s and Guarantor Mr. Sitarām Mahto and Mrs. Babita Kumari for their Parvat Patiya Branch to repay the amount mentioned in the notice being **Rs.15,31,821.99 (Rupees Fifteen Lakhs Thirty One Thousand Eight Hundred Twenty One and Paisa Ninety Nine Only)** within 60 days from the date of receipt of the said notice.

The Borrower/s and Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/s and Guarantor and the public in general that the undersigned has taken **possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act read with Rule 8 of the said rules on this **17th day of December of the year 2025**. The Borrower(s) and Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Indian Bank** for an amount of **Rs.16,32,552.15 (Rupees Sixteen Lakhs Thirty Two Thousand Five Hundred Fifty-two and Paisa Fifteen only)** as on 15.12.2025 and interest thereon.

"We draw attention to the provisions of Section 13(8) of the SARFAESI Act and the Rules framed there under which deals with your rights of redemption over the securities"

**Description of the immovable property**

All that Piece and Parcel of Residential Property Bearing Plot No. 113 (as per KJP Block No. 273/A/113), having area 60.20 Sq. Yard with proportionate undivided inchoate share of Road and C.O.P. admeasuring 20.97 Sq. Mtrs. Land, total admeasuring 81.17 Sq. Mtr. of "Nikanth Residency" with all appurtenances pertaining thereto, standing on land bearing Block No. 273/A, 274 and 275) lying, being and situated at Village Tanthithaya, Sub District Palsana, District Surat, Gujarat – 394305 in the name of Mr. Sitarām Dhanraj Mahto and Mrs. Babita Kumari Sitarām Mahto. Bounded by:- North: Adj. Plot No. 112, South: Adj. Road, East: Adj. Lagu Block, West: Adj. Plot No. 146

**Place : Parvat Patia | Date : 17/12/2025**

Authorized Officer, Indian Bank

**REGIONAL OFFICE - JAMNAGAR****INVITATION OF BIDS / OFFERS FOR PREMISES ON LEASE**



આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો યુએસ ડોલર સામે ૯૦.૩૫ પર ખૂલ્યો

યુએસ ડોલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં ટ્રેડ ફરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે ભારત-યુએસ વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો અભાવ

મુંબઈ,તા.૧૮

શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં ટ્રેડ કરે છે કારણ કે વેપાર સોદાની અનિશ્ચિતતા અને જોખમ-બંધ ભાવનાને કારણે નવા વિદેશી ભંડોળના પ્રવાહને ટેકો મળ્યો ન હતો. ફરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે ભારત-યુએસ વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો અભાવ અને કોર્પોરેટ્સ અને આયાતકારો તરફથી મજબૂત ડોલર માંગ સ્થાનિક એકમ પર દબાણ કરે છે, ભલે બ્રેન્ટ કૂડના ભાવ પ્રતિ બેરલ જીદ્દ ૬૦ ની નજીક રહેતા રોકાણકારોના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડોલર સામે ૯૦.૩૫ પર ખુલ્યો, પછી થોડો મજબૂત થયો અને યુએસ ડોલર સામે ૯૦.૩૨ પર સ્પર્શ્યો. શરૂઆતના વેપારમાં તે અમેરિકન ચલણ સામે



૯૦.૩૮ પર પણ સ્પર્શ્યો. બુધવારે, રૂપિયો તેના સર્વકાલીન નીચલા સ્તરથી ૫૫ પૈસા સુધીને ડોલર સામે ૯૦.૩૮ પર બંધ થયો.

RBI વતી PSU બેંકો ડોલર વેચતી હતી. હસ્તક્ષેપ રકમ USD 6 બિલિયન જેટલી ઊંચી હોઈ શકે છે,” કિનરેક્સ ટ્રેડરી એડવાઈઝર્સ LLP ના ટ્રેડરી હેડ અને એક્ઝિક્યુટિવ

રિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું. “અમે ગુરુવારે ૯૦ થી ૯૧.૦૦ ની રેન્જની અપેક્ષા રાખીએ છીએ, જેમાં ૯૦.૨૫ સપોર્ટ તરીકે અને ૯૦.૭૫ પ્રતિકાર તરીકે રહેશે. આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ ચલણોની ટોપલી સામે ડોલરની મજબૂતાઈનું માપન કરે છે, તે ૦.૦૫ ટકા વધીને ૯૮.૪૧ પર ટ્રેડ કરી રહ્યો

હતો. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ફ્યુચર્સ ટ્રેડમાં ૦.૬૭ ટકા વધીને USD ૬૦.૦૮ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી બજારના મોરચે, ૩૦ શેરોનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૧૪.૦૬ પોઈન્ટ ઘટીને ૮૪,૪૪૫.૫૯ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૧.૧૦ પોઈન્ટ ઘટીને ૨૫,૭૭૭.૪૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૧.૧૭૧.૭૧ કરોડ રૂપિયાના ઈક્વિટી ખરીદ્યા હતા. ભારતીય શેરબજારમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ઇન્ડાઉ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૩૦ વખત ૧% કે તેથી વધુ અને નિફ્ટીમાં ૩૨ વખત વધવટ જોવાઈ હતી. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, સેન્સેક્સમાં માત્ર ૩% અને નિફ્ટીમાં ૪% ની વધવટ થઈ હતી. ટુકડાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની

અસ્થિરતા પછી, બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા હતા. બજારના સુત્રોએ જણાવ્યું હતું કે નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને યુએસ વેપાર નીતિએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બજારની ઊંચી અસ્થિરતામાં ફાળો આપ્યો હતો. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, ઓછા નફારાત્મક સમાચાર, સારી કમાણી અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણને કારણે બજાર સ્થિર થયું હતું. પહેલા બે મહિનામાં તીવ્ર ઘટાડો થયો હતો, ત્યારબાદ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા પછીના મહિનામાં તેજ જોવા મળી હતી. બીજા ભાગમાં બજાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું, પરંતુ પ્રથમ છ મહિનામાં જોવા મળેલા સ્તરોની તુલનામાં લાભ સાધારણ હતો. જ્યારે સુચકાંકો ધીમે ધીમે વધે છે, ત્યારે અસ્થિરતા ઓછી રહે છે.

નવી દિલ્હી,તા.૧૮

EPFO એ નવેમ્બર ૨૦૨૫ થી EES-૨૦૨૫ હેઠળ છ મહિનાની ખાસ પાલન વિન્ડો પૂરી પાડી છે, જે EPF માંથી બાકાત રાખવામાં આવેલા લાયક કર્મચારીઓને સામેલ કરવા માટે શરૂ થાય છે. આ દ્વારા, નોકરીદાતાઓ ૧ જુલાઈ, ૨૦૧૭ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ વચ્ચે થયેલા ડિકોલ્ટને નિયમિત કરી શકે છે. કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરીદાતાઓને EPF યોજનામાંથી બાકાત રાખવામાં આવેલા લાયક કર્મચારીઓને સ્વેચ્છાએ નોંધણી કરાવવા અપીલ કરી છે. આ માટે, શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી નોંધણી યોજના (EFS)-૨૦૨૫ હેઠળ નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થતા છ મહિનાના ખાસ પાલન સમયગાળાની જાહેરાત કરી છે. મંત્રાલય અનુસાર, આ યોજના હેઠળ, નોકરીદાતાઓ ૧



જુલાઈ, ૨૦૧૭ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ વચ્ચે EPF કવરેજથી બહાર રહેલા પાત્ર કર્મચારીઓની નોંધણી કરી શકે છે અને અગાઉની અનિયમિતતાઓને નિયમિત કરી શકે છે. ઈઈજી-૨૦૨૫ ની જોગવાઈઓ અનુસાર, એવા કિસ્સાઓમાં જ્યાં કર્મચારીનું યોગદાન અગાઉ કાપવામાં આવ્યું ન હતું, નોકરીદાતાએ ફક્ત નોકરીદાતાનું યોગદાન, કલમ ૭61

હેઠળ વ્યાજ, લાગુ વહીવટી શુલ્ક અને માત્ર ૧૦૦ નો મર્યાદિત ટંડ જમા કરાવવાની જરૂર રહેશે. આને ત્રણેય EPFO યોજનાઓ હેઠળ સંપૂર્ણ પાલન ગણવામાં આવશે. આને એક વખતની અને સમયસર તક ગણાવતા, EPFO એ તમામ નોકરીદાતાઓને આ તકનો લાભ લેવા અને બધા માટે સામાજિક સુરક્ષાના રાષ્ટ્રીય ધ્યેયમાં યોગદાન આપવા વિનંતી કરી છે.

બિઝનેસ આજકાલ

કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વિક્રમી ધોવાણ થયું

મુંબઈ : રશીયા-યુકેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અમેરિકાની પહેલ અને આ માટે ડિલ પર બન્ને દેશોની સંમતિની રાહ જોવાઈ રહી હતી રશીયાને શરનો માત્ર ચરહે છે કે નહીં એના પર નજર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશીયા આ ડિલ માટે તૈયાર નહીં થાય તો રશીયા પર વધુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ચીમકીએ જીઓપોલિટિકલ ટેન્શનનું જોખમ રહેતાં આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. બીજી તરફ ભારતીય રૂપિયાનું અમેરિકાના ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલું વિક્રમી ધોવાણ આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ અટકતા અને છેલ્લા સાત મહિનાની સૌથી ઝડપી રિકવરી જોવાયા છતાં ફંડો શેરોમાં મોટી ખરીદીથી દૂર હળવા થતાં જોવાયા હતા.

ગોયેન્કા ગ્રૂપ પશ્ચિમ બંગાળમાં રૂા.૧૫,૮૦૦ કરોડનું રોકાણ કરશે

નવીદિલ્હી:આરપી-સંજીવ ગોયેન્કા ગ્રુપના ચેરમેન સંજીવ ગોએન્કાએ ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ૧૫,૮૦૦ કરોડના મૂડી રોકાણ (મૂડીખર્ચ)ની જાહેરાત કરી. આ રોકાણનો હેતુ રાજ્યમાં ઉર્જા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોમાં માળખાગત સુવિધાને મજબૂત બનાવવાનો રહેશે. બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી કોફેલેવ ૨૦૨૫ ને સંબોધતા, સંજીવ ગોયેન્કાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિણાયક નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તે રાજ્યમાં રોકાણને વેગ આપવા માટે મદદ કરે છે. તેમણે નોંધ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ, તેમના જૂથે છેલ્લા વર્ષમાં ૨૬,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. રોકાણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત છે.

દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ એલ કેટરટને હલ્દીરામમાં રોકાણ કર્યું

નવી દિલ્હી : અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એલ કેટરટને ભારતની પેકેજડ ફૂડ કંપની હલ્દીરામમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ રોકાણ કર્યું છે. આ પાર્ટનરશિપમાં એલ કેટરટન હલ્દીરામને સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રિબ્યુશનને સુધારવા, ભૌગોલિક વિસ્તરણ અને ટેલેન્ટ રૂઝવણમેન્ટમાં સપોર્ટ આપશે. કંપની હવે એલ કેટરટનની ગ્લોબલ એક્સપર્ટાઈઝ, ઇન્ડસ્ટ્રી નેટવર્ક અને લોકલ ટેલેન્ટનો લાભ લઈ શકશે. ખાસ કરીને ફર્મના ઈન્ડિયા એક્ઝિક્યુટિવ ચેરમેન સંજીવ મહેતાના અનુભવનો ફાયદો થશે, જેઓ અગાઉ હિન્દુસ્તાન યુનિલિવરના ચેરમેન અના MD રહી ચૂક્યા છે. સંજીવ મહેતાએ કહ્યું, “હલ્દીરામ એક આઈકોનિક ઈન્ડિયન બ્રાન્ડ છે, જે એથનિક સ્નેક્સ કેટેગરીમાં દેશનું લીડર છે.

Paytmને વિદેશી ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ એગ્રીગેટર તરીકે મંજૂરી

નવી દિલ્હી: કિનટેક ફર્મ One97 કોમ્પ્યુનિકેશન્સે ગુરુવારે જણાવ્યું હતું કે તેની પેટાકંપની Paytm પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ભૌતિક (ઓફલાઈન) ચુકવણીઓ અને કોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે અધિકૃતતા પ્રાપ્ત થઈ છે. આ મંજૂરી સેન્ટ્રલ બેંક દ્વારા ગયા મહિને PPST ને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે આપવામાં આવેલી મંજૂરી ઉપરાંત છે. RBIએ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, One 97 કોમ્પ્યુનિકેશન્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, Paytm પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડને ચુકવણીઓ અને કોસ-બોર્ડર વ્યવહારો માટે ચુકવણી એગ્રીગેટર તરીકે કામ કરવા માટે અધિકૃત કર્યાં છે.

નેત્રંગ નજીક પસાર થતી રોયલ્ટી વગરની ઓવરલોડ માટી ભરેલ ટ્રકો ઝડપાતા ચક્રચાર



ભરૂચ: ભરૂચ જિલ્લાની આદિવાસી પટ્ટી ગણાતા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓ વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવે છે. ખનિજ માફિયાઓ મોટાપાયે રોયલ્ટી ચોરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો લાંબા સમયથી ઉઠે છે. દરમિયાન ઝઘડિયા પ્રાપ્ત અધિકારી ગતરોજ તા.૧૭ મીના રોજ નેત્રંગ મામલતદાર કચેરીની મુલાકાતે આવ્યા હતા,તે દરમિયાન બપ 1૦ના ર થી ૩ ના ગાળામાં વાલિયા થી નેત્રંગ તરફ જઈ રહ્યા હતા, તે સમયે

ઈટોના ભદ્રામાં વપરાતું પોણું ( માટી ) ભરેલ બે ટ્રકો રોયલ્ટી વિનાની અને ઓવરલોડ જથ્થો ભરીને પસાર થતી જોવા મળતા પ્રાન્ત અધિકારીએ આ બન્ને ટ્રકો રોકીને તપાસ કરી હતી. રોયલ્ટી વગર આવી રહેલ આ ટ્રકોને વધુ તપાસ માટે પ્રાન્ત અધિકારીએ નેત્રંગ પોલીસને સોંપી હતી.વધુમાં મળતી વિગતો

વાલિયા તરફ મુજબ ટ્રક ચાલકો ટ્રકો મુકીને સ્થળ ઉપ થી નેત્રંગ તરફ રથી નાશી ગયા હતા, ટ્રકોના જરૂરી કાગળો

મળી શક્યા ન હતા. નાયબ કલેક્ટરે ધોળે દિવસે ખનિજ ચોરી કરતા માફિયાઓને

ઝડપી લેતા ખનિજ ચોરોમાં ફડકાટ ફેલાઈ જવા પામ્યો હતો.



**NILA INFRASTRUCTURES LIMITED**  
(CIN: N45201GJ1990PLC013417)  
Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.  
Phone: + 91 79 4003 6817/18 Fax: + 91 79 26873822  
E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

**NOTICE TO THE SHAREHOLDERS**

SEBI has permitted opening of a special window to facilitate re-lodgement of transfer requests of physical shares lodged prior to the deadline of 01 April 2019 and rejected / returned due to deficiency in the documents. The shareholders are requested to refer SEBI Circular No. SEBI/HO/MIRRO/MIRSD-PoD/PIR/2025/97 dated 02 July 2025, for detailed information. As per the said circular only those shareholders whose transfer deeds were rejected / returned due to deficiency in documents, are permitted to re-lodge their transfer requests. The re-lodgement can be made only upto 08 January 2026 by submitting original transfer documents, along with corrected or missing details to the RTA of the Company MCS Share Transfer Agent Limited at its office address 201, 2nd Floor, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad – 380009. Helpline Number +91 79-26580461/62; Email: mcstaahmd@gmail.com; secretarial@nilainfra.com. The shares that are re-lodged for transfer shall be issued only in the demate mode. For any clarification or guidance, the shareholders can contact the above referred contact details.

Date: 18-12-2025  
Place: Ahmedabad

**For Nila Infrastructures Limited**  
Dipen Parkhi  
Company Secretary



**NILA SPACES LIMITED**  
(CIN: L45100GJ2000PLC083204)  
Registered Office: 1<sup>st</sup> Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.  
Phone: + 91 79 4003 6817/18 Fax: + 91 7930128371  
E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

**NOTICE TO THE SHAREHOLDERS**

SEBI has permitted opening of a special window to facilitate re-lodgement of transfer requests of physical shares lodged prior to the deadline of 01 April 2019 and rejected / returned due to deficiency in the documents. The shareholders are requested to refer SEBI Circular No. SEBI/HO/MIRRO/MIRSD-PoD/PIR/2025/97 dated 02 July 2025, for detailed information. As per the said circular only those shareholders whose transfer deeds were rejected / returned due to deficiency in documents, are permitted to re-lodge their transfer requests. The re-lodgement can be made only upto 08 January 2026 by submitting original transfer documents, along with corrected or missing details to the RTA of the Company MCS Share Transfer Agent Limited at its office address 201, 2nd Floor, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad – 380009. Helpline Number +91 79-26580461/62; Email: mcstaahmd@gmail.com; secretarial@nilaspaces.com. The shares that are re-lodged for transfer shall be issued only in the demate mode. For any clarification or guidance, the shareholders can contact the above referred contact details.

Date: 18-12-2025  
Place: Ahmedabad

**For NILA SPACES LIMITED**  
Gopi Dave  
Company Secretary



**SAMBHAHV MEDIA LIMITED**  
(CIN: L67120GJ1990PLC014094)  
Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Prenchandnagar Road, Satellite, Ahmedabad - 380 015  
Phone: + 91 79 2687 3914/15/16/17 Fax: + 91 79 2687 3922  
Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com

**NOTICE TO THE SHAREHOLDERS**

SEBI has permitted opening of a special window to facilitate re-lodgement of transfer requests of physical shares lodged prior to the deadline of 01 April 2019 and rejected / returned due to deficiency in the documents. The shareholders are requested to refer SEBI Circular No. SEBI/HO/MIRRO/MIRSD-PoD/PIR/2025/97 dated 02 July 2025, for detailed information. As per the said circular only those shareholders whose transfer deeds were rejected / returned due to deficiency in documents, are permitted to re-lodge their transfer requests. The re-lodgement can be made only upto 08 January 2026 by submitting original transfer documents, along with corrected or missing details to the RTA of the Company MCS Share Transfer Agent Limited at its office address 201, 2nd Floor, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad – 380009. Helpline Number +91 79-26580461/62; Email: mcstaahmd@gmail.com; secretarial@sambhaav.com. The shares that are re-lodged for transfer shall be issued only in the demate mode. For any clarification or guidance, the shareholders can contact the above referred contact details.

Date: 18-12-2025  
Place: Ahmedabad

**For Sambhaav Media Limited**  
Manisha Mali  
Company Secretary